

### SYMBOLIC POSSESSION NOTICE

**ICI Bank** Branch Office: ICI Bank Ltd Office Number 203 B, 2nd Floor, Road No. 1 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane (West)- 406004

The Authorised ICI Bank Officer under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest Enforcement Rules, 2002, issued (hereinafter referred to as the "Borrower(s)"), is hereby notified, to repay the amount mentioned in the Notice within 60 days from the date of receipt of the said Notice.

Having failed to repay the amount, the Notice is issued to the borrower and the public in general that the undersigned has taken symbolic possession of the property described below, by exercising powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property. Any dealings with the property will be subject to charges of ICI Bank Limited.

Sr. No.	Name of the Borrower(s) / Loan Account Number	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs)	Name of Branch
1.	M/s. Smitan Rightcare Pvt. Limited & Mr. Manish Jawaharlal Goswami & Mrs. Rakhi Manish Goswami-177705180319	Unit No. 712, Seventh Floor of Block No. A-1, In The Building Known As Radhe Kishan Business Park, Constructed on Na Land Bearing Consolidated Revenue Survey No. 22/27 of Final Plot No. 96/5, 96/7 & 96/6, Revenue Survey No. 22/28, T.P. Scheme No. 531 (concurrent) Moje Village Isanapur, Taluka Maninagar, Within The Sub-Registration District of Ahmedabad-15 (NOR) & Registration District Ahmedabad-15, January 14, 2025	November 11, 2024 Rs. 1756411.00/-	Ahmeda -bod

The above-mentioned borrower(s)/Borrower(s) is/are hereby issued a 30 day Notice to repay the amount, also the mortgaged properties will be sold after 30 days from the date of publishing this Notice, as per the provisions under Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: February 17, 2025  
Place: Ahmedabad

Sincerely Authorised Signatory  
For ICI Bank Ltd.

### CHANGE OF NAME

I RESHMA BANU spouse of No. 143866/91W Name BALUCH RASHID SHERMANAD resident of Bajaran Chowk, Hari Krushn Nagar Navi Vasahat Dhari Distt Ahmed 365640 have changed my Name from RESHMA BANU to RESHMABANU RASHID BALUCH

**pnb** **ਪੰਜਾਬ ਨੈਸ਼ਨਲ ਬੈਂਕ** **punjab national bank**

Ishwari Krupa Building, Opp. Saffron Tower, Fatehgunj, Vadodra-390002 (Guj). Email: B03405@pnb.co.in

### Appendix-IV [See Rule 8(1)] PHYSICAL POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorised Officer of Punjab National Bank, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued Demand Notice Dated 11.10.2022 calling upon the Borrowers/Guarantors/Mortgagors Mr. Dineshbhai Shankarbal Parmar & Mr. Shankarbal Ranchodhbhai Parmar to repay the amount mentioned in the notice being Rs. 8,70,380 (Rupees Eight Lakh Seventy Thousand Three Hundred Eighty Only) as on 30.09.2022 payable with further interest and expenses until payment in full, within 60 days from the date of receipt of the said notice.

The Borrowers/Guarantors/Mortgagors having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Guarantors/Mortgagors and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the 11th day of February of the year 2025.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrowers/Guarantors/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Punjab National Bank for an amount of Rs. 11,21,094.56 (Rupees Eleven Lacks Twenty One Thousand Ninety Four and paise Fifty Six Only) as on 10 Feb 2025 payable with further interest and costs thereon until payments/realization in full.

### SCHEDULE OF IMMOVABLE PROPERTY

All that piece and parcel of Flat No. D-104, First Floor, Prathna Flat, Hari Road, Vadodra having its super built up adm. 616 Sq. Ft. On land bearing R.S. No. 158 (Old No. 245) T.P. Scheme No. 172 of Moje Savad, Tal. & Dist. Vadodra Bounded East - Flat No. D-103, North After margin Prathana Flats Compound, West: Common Plot of Prathana flat, South: Passage.

Date: 11.02.2025 - Place: Vadodra  
Authorised Officer - Punjab National Bank

**Bank of Baroda**

Surat City Region - 2 : Baroda Sun Complex, Ghod Dod Road, Surat-395007. Ph. : +91 94093 16904, +91 79038 88672

### E-AUCTION SALE NOTICE

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6 (2) & (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Refer to Secured Immovable / Movable Assets Under the Securitisation And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 (herein After Referred To As The Act). Notice is hereby given to the public in general and in particular to the Borrower(s), Mortgagor(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis for recovery of dues in below mentioned account/s. The details of borrower/s/Mortgagor/Guarantor/s/Secured Asset/s/Dues/Reserve Price/E-Auction date & Time, EMD and Bid Increase Amount are mentioned below.

Sr. No.	Branch	Borrower's name & Demand Notice date	Owner of property	Description of Property (Detail)	Type of Property (Row House/Flat/Res. Pooled/Pooled Building Possession Type / Symbolic)	Area (sq. ft.) (as per sanctioned plans) & Other Charges	Due (in Lacs) (as per up to 09.02.2025) Less Reserve Price (if any)	1. Reserve Price (Actual) 2. EMD (5% of Reserve Price) 3. Bid Increase Amount	Contact Person and Mob. No.
<b>Auction Date 20.03.2025, Time : 02:00 PM to 06:00 PM, Inspection Date 18.03.2025 To 19.03.2025</b>									
1.	BALSHWAR KALASHCHAND SHAMDA: 03-10-2024	Kalashchand Barajamal Sharma		All that piece and parcel of immovable property bearing Plot No. 218 measuring 42.28 sq.mts. (as per sanctioned plans) and 85.47 sq. Mtrs. (as per booking plans) of "Siddhi Vinayak Residency" together with undivided proportionate share in road, water, drainage, lift and terrace of said apartment and its related internal and external rights, situated on the N.A. land bearing Revenue Survey No. 98, Block No. 123 of Village: Bagumara, Sub-District: Palasana, District: Surat.	Row House Symbolic	8.09 + Other Charges	1) 1219000 2) 121900 3) 10000	1) 1219000 2) 121900 3) 10000	Rajnah Sah: 9890026616
2.	KATARGAM NAINABEY PRAVINBHAI PATEL: 14-10-2024	Nayabhai Pravinbhai Patel & Mohit Pravinbhai Patel		Flat No. 404 on Fourth Floor of Building 'B' of the society known as "Om Regency" at Flat measuring Carpet Area: 43.04 Sq. Mts. & Built-up Area: 51.948 Sq. Mts. and the undivided proportionate share in land of the building, constituting of the Non-Agriculture Land bearing Rev. Survey No. 791 measuring 11026 Sq. Mts. & Revenue Survey No. 871 measuring 11837 Sq. Mts. T.P. Scheme No. 23 (Singapore-Tunk), Original Plot No. 51, Final Plot No. 108 measuring 1850 Sq. Mts. situated at Moje Village: Singapore, Sub-District: Taluka: Surat City (Katargam), District: Surat.	Flat Symbolic	22.23 + Other Charges	1) 3125000 2) 312500	1) 3125000 2) 312500	Kushal Parikh: 9890026730
3.	KATARGAM KOTIYHA BANUCHANDHAI BABUBHAI: 20-09-2024	Vidhibhai Banuchandhai Kotiyha & Banuchandhai Babubhai Kotiyha		Flat no 404, 4th floor as per Site Building No H/2(as per Approved Plan on 3rd Floor of Building No A6-B) measuring 47.0 sq mtr of the society known as "Amal Kari" situated at Revenue Survey No. 124, Old Khodwad-133, New Khodwad-3039 T.P Scheme No. 47 (Khodwad-133) of No 39/0a and 90/Badm 31037 sq mtr Final Plot No 90 adm 1922 sq mtr of Village: Khodwad, Tal. Karanj, Dist: Surat.	Flat Symbolic	10.64 + Other Charges	1) 1350000 2) 135000	1) 1350000 2) 135000	Kushal Parikh: 9890026730
4.	KATARGAM ARJUN NARAYAN MISTRI: 07-08-2024	Arjun Narayan Mistri & Jyoti Anjan Mistri		Plot No 184 measuring area 48.00 sq yards as per K.P. Block No 124/184 measuring about 40.18 sq mtrs of Rash Residency along with undivided proportionate share measuring 21.18 sq mtrs in the said society of the land bearing Block No 124, Revenue Survey Nos. 115 of Vill: Karaj, Tal: Palasana, Dist: Surat.	Row House Symbolic	9.35 + Other Charges	1) 788000 2) 78800	1) 788000 2) 78800	Kushal Parikh: 9890026730
5.	KHOLWAD PRAKASHKUMAR PARMANANDHAI SHRIMALI: 01-08-2017	Prakashkumar Parmanandhai Shrimali		Property No 538, Mahayavani Mohalla, Kholwad, Tal: Karanj, Dist: Surat measuring about 190 Sq Ft 190 Sq Mtrs of Vill: Kholwad, Tal: karanj, Dist: Surat 94190	Row House Symbolic	4.78 + Other Charges	1) 1525000 2) 152500 3) 10000	1) 1525000 2) 152500 3) 10000	Amil Mahata: 9890021068

Sr. No.	Branch	Borrower's name & Demand Notice date	Owner of property	Description of Property (Detail)	Type of Property (Row House/Flat/Res. Pooled/Pooled Building Possession Type / Symbolic)	Area (sq. ft.) (as per sanctioned plans) & Other Charges	Due (in Lacs) (as per up to 09.02.2025) Less Reserve Price (if any)	1. Reserve Price (Actual) 2. EMD (5% of Reserve Price) 3. Bid Increase Amount	Contact Person and Mob. No.
<b>Auction Date 06.03.2025, Time : 02:00 PM to 06:00 PM, Inspection Date 04.03.2025 To 05.03.2025</b>									
6.	MSME MIS SAHANJAND TEXTILES: 18-04-2024	Vaishali Hahabhai Vaishali Hahabhai		Plot No. 27 measuring 334.44 Sq. Mtrs equivalent to 400.00 Sq. Yards (here K.P. Block No. 107/21 in the area known as "Gandhi Industrial Estate", Behind Yantaram Autom. Pvt. Ltd. situated on the land bearing Block No. 137 (Rev. S. No. 141) of Village: Navagam, Taluka: Karanj, Dist: Surat-394185	Industrial Plot Physical	132.03 + Other Charges	1) 1640000 2) 164000 3) 50000	1) 1640000 2) 164000 3) 50000	Sanjay Pandey: 9890021055
7.	DUNIPAL RAMESHBHAI PADASALA: 16-11-2023	Dinpal Rameshbhai Padasa		Flat no 201 measuring around 52.89 sq. meters on the 2nd Floor of Building No. A/45 (as per sanctioned Plan Flat No. 202 on the 2nd Floor of Building No. A/45) of "Om Township Part- III", situated on the land bearing R.S. No. 176, Block No. 177 (New Block No. 228) of Village: Pasodra, Tal: Karanj, Dist: Surat.	Flat Physical	12.39 + Other Charges	1) 1075000 2) 107500	1) 1075000 2) 107500	Harminder Singh: 9890026232
8.	MEDICAL COLLAGE AJAY JAGDISCHANDRA PALAWALA: 04-10-2018	Jyoti Anjan Patilwala		Flat No 504, Sainath Apartment, Hanuman Sher, B/Chamunda Restaurant, Sangrampur, Surat.	Flat Physical	14.64 + Other Charges	1) 850000 2) 85000 3) 10000	1) 850000 2) 85000 3) 10000	Amilagar Pandey: 9890026775
9.	BHAGTALAO PATEL HASMUKHBHAI VAGHUBHAI: 03-02-2023	Patel Hasumukhbhai Vaghubhai		Flat No.104, on the 1st floor which super built-up area measuring 1034 sq. Fts. and built-up area measuring 600 sq. Fts. i.e. 55.75 sq. Mtrs along with undivided proportionate share in road, water, drainage, lift and terrace of said apartment and its related internal and external rights, situated at building No. A-9, in the society known as "Shiv Sai Residency", bearing revenue survey no.76, block no. 101/a, situated at non-agriculture land of Moje Village: Vankande, Sub Dist: Palasana, Dist: Surat.	Flat Physical	14.81 + Other Charges	1) 765000 2) 76500 3) 10000	1) 765000 2) 76500 3) 10000	Pranali S Nene: 9890026619
10.	BHAGTALAO LAXMAN VISHWANATH GOHEL: 27-10-2022	Laxman Vishwanath Gohel		Flat No.104, which super built-up area measuring 1034 sq. Fts. and built-up area measuring 600 sq. Fts. i.e. 55.75 sq. Mtrs, along with undivided proportionate share in parking, stairs, passage, overhead, tank, drainage, lift and terrace of said apartment and its related internal and external rights, situated at building No. A-9, in the society known as "Shiv Sai Residency", bearing revenue survey no.76, block no. 101/a, situated at non-agriculture land of Moje Village: Vankande, Opposite Siddhi Faliya, Near Chhatan Sugar Factory, Chhatan Railway Station, Sub Dist: Palasana, Dist: Surat.	Flat Physical	8.97 + Other Charges	1) 765000 2) 76500 3) 10000	1) 765000 2) 76500 3) 10000	Pranali S Nene: 9890026619
11.	KATARGAM PRAVIN JADAVBHAI LADUMIR: 21-06-2024	Pravin Jadavbhai Ladumir & Rajesh Pravinbhai		All that piece and parcel of Immovable property bearing Plot No.130 (As per village form no.07/12 Block no. 262/130) plot area measuring 91.91 sq mtrs together with undivided proportionate share in Road and COP measuring 66.69 sq mtrs totalling measuring 158.60 sq.mtrs of Ananda Green Valley situated on the land bearing Blockno.262+264 measuring 67380.00 sq.mtrs of village: Karmala, sub-district taluka Dipad, District-Surat.	Row House Physical	30.55 + Other Charges	1) 2508000 2) 250800 3) 10000	1) 2508000 2) 250800 3) 10000	Kushal Parikh: 9890026730
12.	KATARGAM KALURIBHAI GOPALBHAI THUMMAR: 29-06-2021	Kalabhai Gopalbhai Thummar		Registered Mortgage of Land and building at Block no.54/A, Revenue Survey No 37 Flat No A/2, 202, Rameshwar Residency Near Shreeji Row House, Moje Vm Gam, Sub Dist Karanj, Surat-394189 adm about 612.14 Sqare Feet i.e. 56.86 Mtrs.	Flat Physical	13.82 + Other Charges	1) 893000 2) 89300 3) 10000	1) 893000 2) 89300 3) 10000	Kushal Parikh: 9890026730
13.	NAVAVARACHA SOLANKI MUNABHAI DHARAMSHIBHAI: 10-04-2024	Anantbhai Munabhai Solanki		Plot No. 05 Rajnandini Residency, Vibhag 1, B/S Shubhamin Flaw House, Near Vijai Villa Residency, Umrna, Dipad, Surat-394150.	Row House Physical	18.27 + Other Charges	1) 1505000 2) 150500 3) 10000	1) 1505000 2) 150500 3) 10000	RANUJITH K: 9890021082
14.	BALSHWAR SURESHBHAI MANGALBHAI SOLANKI: 18-04-2024	Sureshbhai Mangalbhai Solanki & Sangeeta Sureshbhai Solanki		Flat No. A-401, measuring built-up area 71.08 sq. Mtrs on 4th floor of Building Interest No. A in the low-rise complex which is known and named as "SAPULIN RESIDENCY" along with undivided proportionate share in the undermath land of the said building and the whole complex project is situated on the non-agriculture land bearing Final Plot Nos. 248 & 249 of T.P Scheme No. 70 Chhaprabhatana Anrok- Kustad- Ussar, Block Nos. 186, 187, 189 palke and 190 total area measuring about 3882.96 sq mtrs of Village: Utran, Sub-District: Anand, District: Surat.	Flat Physical	24.70 + Other Charges	1) 2066000 2) 206600 3) 10000	1) 2066000 2) 206600 3) 10000	Rajnah Sah: 9890026616

**Statutory 30 Days Sale Notice For Sr. No. 1 to 5 And Statutory 15 Days Sale Notice For Sr. No. 6 to 14 Under SARFAESI Act to Borrower / Guarantor / Mortgagor**

For all property bid increment amount will be Rs. 10,000/- (Rupees Ten Thousand Only) For detailed terms and conditions of sale, please refer visit to the website link: <https://www.bankofbaroda.com/e-auction.htm>

For all property bid increment amount will be Rs. 10,000/- (Rupees Ten Thousand Only) For detailed terms and conditions of sale, please refer visit to the website link: <https://www.bankofbaroda.com/e-auction.htm>

Date: 17.02.2025, Place : Surat  
Authorised Officer, Chief Manager, Bank of Baroda

**Bandhan Bank** Regional Office: Netaji Marg, N. Mithakhali Six Roads, Ellisbridge, Ahmedabad-6. Phone : +91-79-26421671-75

### SYMBOLIC POSSESSION NOTICE

NOTICE is hereby given under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, the Authorized Officer issued demand notice to the borrower(s) on the date mentioned against the account stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice. The borrower(s) having failed to repay the amount, notice is hereby given to the borrower(s) and the public in general that the undersigned has taken the symbolic possession of the property described herein below under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the date mentioned against the account. The borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the provisions of the bank for the amounts, interest, costs and charges thereon until payments/realization in full.

Name of Borrower(s), Guarantor & Loan Account No.	Description of the property mortgaged (Secured Asset)	Date of Demand Notice	Date of Symbolic Possession Notice	D's Amount as on date of Demand Notice
Mr.Falgunbhai Somabhai Chauhan Mrs.Dhyanbhai Falgunbhai Chauhan 2003306004022	All that piece and parcel of the immovable property measuring area 44 sq.mtrs, Survey No. 83 paiki 1, Khata No. 21741, Plot No.8 Paiki South side, Tulashidham Society, Sampa Road, Opp. Sankarji Temple, Moje Yavdi Buzurg Taluka: Godhra, Dist: Panchmahal, Gujarat-389001 situated at and bounded by: North: Remaining Land of this Plot Paiki East: this Land of 6 meter Road, West: Adj. Survey No. , South: Plot No.7	17.08.2024	11.02.2025	Rs. 5,74,974.85
Mr.Natarajal Bikhilal Prajapati Mrs.Ramibhai Natarajbhai Prajapati 2003306004161	All that piece and parcel of the immovable property measuring area 43-81-85 sq. mtr., situated at Survey No.989 Paiki 4, Plot No.-27 Paiki Middle Side, Radhe Krishna Park, Ahmedabad Road, Behind Banjara Park, Moje & Taluka: Godhra, Dist: Panchmahal, Gujarat-389001 and bounded by: North: Land of this Plot Paiki, East: 6 meter road, West: Survey No.951/11 Paiki, South: Land of this Plot Paiki	17.08.2024	11.02.2025	Rs. 11,24,490.74
Mr.Kantibhai Somabhai Chauhan Mrs.Premibhai Kantibhai Chauhan Mr.Mitral Kantibhai Chauhan 2003306004292 2003306003963	All that piece and parcel of the immovable property measuring area about 44 sq.mtr situated at Khata No. 21741, Revenue Survey No. 83 Paiki 1, Plot No. 7 Paiki South side, Tulashidham, Sampa Road, Opp. Sankarji Temple, Moje & Taluka: Godhra, Dist: Panchmahal, Gujarat-389001 and bounded by: North: Remaining Land of this Plot, East: Boundary of 6 meter Road of our ownership Land, West: Boundary of Adj. Survey No., South: Boundary of Plot No.8	23.08.2024	11.02.2025	Rs. 11,93,148.19 (Aggregating amount)

Place: Godhra-Panchmahal  
Date: 17/02/2025

Authorised Officer  
Bandhan Bank Limited

**Bank of Baroda** Zonal Stressed Assets Recovery Branch, Ahmedabad Zone, 4th Floor, Bank of Baroda Towers, N. Law Garden, Ellisbridge, Ahmedabad-390015. Ph. 0792475154. Email: amahm@bankofbaroda.com

### SALE NOTICE FOR SALE OF MOVABLE AND IMMMOVABLE PROPERTIES

"APPENDIX-IVA [See proviso to Rule 6(2) & (6)]"

E-Auction Sale Notice for Sale of Movable and Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6 (2) & (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described movable/immovable properties mortgaged/charged/hypothecated to Bank of Baroda, the Secured Creditor, the (Physical Possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" without recourse basis on 10th March, 2025 for recovery of below mentioned account/s. The details of Borrower(s)/Guarantor(s)/Secured Asset/s/Dues/Reserve Price/Auction date & Time, EMD and Bid Increase Amount are mentioned below-

Sr. No.	Name & address of Borrower's/Guarantor/s	Total dues	Description of Properties	Reserve Price EMD & Bid Increase Amount
1	M/s. Ashapura Food Products (Partnership Firm) Revenue Survey No. 1A/P1/P2 paiki, at and Post Village- Nesada, Taluka- Chauthan, District-Banskantha (Gujarat)-386320 Partner/ Guarantor : Jashwanthai Bhavanbhai Thakkar, Manekal Kantilal Thakkar, Bharatkumar Muljibhai Thakkar, Chandrikabai Manekal Thakkar, Madhusudan Bhavanbhai Thakkar, Dhariaben Bharabhai Thakkar	Rs. 4,04,44,054.55 (Rupees Four Lakh Forty Four Thousand Four Hundred Fifty Four and Fifty Paise only) as on 15.02.2025 (With reference to Demand Notice as per section 13(2) Dated: 03.10.2018)	Lot No. (1): All that piece and parcel of N.A. Land bearing Revenue Survey No. 20/2 paiki Plot No. 46, 47 & 48, measuring in Sq. Meter 540 situated within the village limit of Bhabhar-Juni Sub-District Bhabhar and Registration District Banskantha, Gram Panchayati Akarni, Census No. 4784, 4785, 4786 & 4787 in the name of Mrs. Thakkar Chandrikabai Manekal (Physical Possession) Boundaries: East: West: West: North: Residential Plot No. 45 & 50, South: Way, Encumbrance: Not known	Reserve Price: Rs. 50,25,000/- EMD : Rs. 5,02,500/- Bid. Inc. : Rs. 10,000/-
			Lot No. (2): All that piece and parcel of immovable property being N.A. Land bearing Revenue Survey No. 1a/p1/p2 Plot, measuring in Sq. Meter 407-456, situated within the Village limit of Nesada Sub District-Bhabhar and Registration District Banskantha, Gram Panchayati Akarni No. 145, in the name of Mr. Thakkar Manekal Kantilal (Lessor) and M/s Ashapura Food Products, partnership firm (Lessee) (Physical Possession) Boundaries: East: Road / Way, West: R.S. No. 1a/p1/p1 Land, North: Road/Way, South: R.S. No. 1a/p1/p1 Land, Encumbrance: Not known	Reserve Price: Rs. 70,00,000/- E M D : Rs. 7,00,000/- Bid. Inc. : Rs. 1,00,000/-

E-Auction Date : 10.03.2025 and E-Auction Time: 02:00 PM to 06:00 PM (unlimited extension of 10 minutes)  
Inspection Date : 28.02.2025 and Inspection Time : 11:00 AM to 02:00 PM

For detailed terms and conditions of sale, please refer/visit to the link provided in <https://www.bankofbaroda.in/e-auction.htm> and online auction portal [banknet.com](http://banknet.com). Also, prospective bidders may contact the authorized officer, Mr. Vijay Kumar Mishra, Chief Manager, ZOSARB, Ahmedabad, Mob. No. 9867619857/CS/ITDS as per Government Rules applicable shall be payable by purchase on sale of Movable/Immovable Assets.

Date: 17.02.2025 | Place : Ahmedabad  
Sd/- Authorized Officer, BANK OF BARODA

**Prabha Energy Limited**  
CIN: U40102GJ2009PLC057716  
Regd. Office: 12A, Ashishree Corporate Park, Opp Swagat BRTS Bus Stop Amli-Bopal Road, Amli, Ahmedabad, Gujarat-380058  
Ph: 0217-298510 E-mail: cs@prabhaenergy.com Web: prabhaenergy.com

### EXTRACTS OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON 31<sup>ST</sup> DECEMBER, 2024

(₹ In Lakhs except per share data)

Sr No	Particulars	QUARTER ENDED			NINE MONTHS ENDED			YEAR ENDED
		31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024	
		Unaudited	Unaudited	Restated Unaudited	Unaudited	Restated Unaudited	Restated Audited	
1	Total Income from Operations (net)	102.82	98.03	75.98	297.19	293.76	224.02	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional Items)	(16.51)	(16.76)	(16.34)	(64.00)	(115.70)	(125.31)	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional Items)	(16.51)	(16.76)	(16.54)	(64.00)	(115.70)	(125.31)	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional Items)	(16.09)	(6.85)	(8.81)	(45.93)	(84.04)	(94.65)	
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(16.09)	(6.85)	(8.81)	(45.93)	(84.04)	(94.65)	
6	Equity Share Capital (Face Value of ₹. 1/- per share)	1,369.06	1,369.06	1,369.06	1,369.06	1,369.06	1,369.06	
7	Other Equity	-	-	-	-	-	43,066.53	
8	Earning per share of ₹. 1/- each (From Continuing and Discontinuing Operations)	(0.01)	(0.01)	(0.01)	(0.04)	(0.06)	(0.07)	
9	Diluted (in ₹.)	(0.01)	(0.01)	(0.01)	(0.04)	(0.06)	(0.07)	

The above consolidated financial results of Prabha Energy Limited, its subsidiary have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 14th February, 2025. The statutory auditor has carried out Limited Review of above consolidated financial results of the Company.

### KEY STANDALONE FINANCIAL INFORMATION IS GIVEN BELOW:

Sr No	Particulars	QUARTER ENDED			NINE MONTHS ENDED			YEAR ENDED
		31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024	
		Unaudited	Unaudited	Restated Unaudited	Unaudited	Restated Unaudited	Restated Audited	
1	Total Income from Operations (net)	41.78	40.83	16.44	122.61	36.46	98.45	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional Items)	(30.46)	(38.25)	(33.08)	(110.41)	(125.49)	(138.19)	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional Items)	(30.46)	(38.25)	(33.08)	(110.41)	(125.49)	(138.19)	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional Items)	(23.04)	(23.29)	(24.76)	(77.54)	(83.91)	(104.81)	
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(23.04)	(23.29)	(2				

